



ડાઉનટાઉન બ્રેમ્પટનમાં પરિવર્તન કામગીરી ચાલુ છે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (એપ્રિલ 20, 2022) – ડાઉનટાઉન બ્રેમ્પટનમાં પરિવર્તન કામગીરી ચાલુ છે, આ અઠવાડિયે રીજીયન ઓફ પીલ આ વિસ્તારની પાણીની મુખ્ય લાઇનો (વોટર મેઇન) અને ગટરો (સેનિટરી સીવર્સ) બદલીને બાંધકામનો પહેલો તબક્કો શરૂ કરશે.

બાંધકામનો તબક્કો 1 દરમિયાન, રીજીયનના કોન્ટ્રાક્ટર ક્વીન સ્ટ્રીટ ઈસ્ટની બે વચલી લેનનો કબજો લેશે, અને ક્વીન સ્ટ્રીટ લગભગ મુખ્ય સ્ટ્રીટથી GO ટ્રેક્સ ઈસ્ટ ઓફ ચેપલ સ્ટ્રીટ સુધી ધટીને દરેક દિશામાં એક લેનની થશે. આ ટ્રાફિક કંટ્રોલ સેટઅપ ભૂગર્ભ માળખાગત સગવડ અને સપાટીના કામોના બાંધકામ માટે સુધારવામાં આવશે. જોકે, ક્વીન સ્ટ્રીટ પર બધાં સમયે એક લેનનો ટ્રાફિક જાળવવામાં આવશે.

ક્વીન સ્ટ્રીટ પર બાંધકામ કામગીરી ચાલુ હોય તે વિસ્તારમાં સ્ટ્રીટ-પર પાર્કિંગ ઉપલબ્ધ રહેશે નહીં. મફત પાર્કિંગ આ [મ્યુનિસિપલ પાર્કિંગ ગેરેજ](#)માં ઉપલબ્ધ રહેશે: નેલ્સન સ્ક્વેર, માર્કેટ સ્ક્વેર, વેસ્ટ ટાવર, સીટી હોલ અને જોલ્ન સ્ટ્રીટ.

રીજીયન ખાતરી કરશે કે ધંધાઓ માટે ઈમારતો પાછળનો લેનવે ડિલિવરી સંબંધિત પ્રવેશ માટે સુલભ રહે. આ પહેલા તબક્કામાં, હાર્મ્સવર્થ લેન અને ગાર્ડન સ્ક્વેર લેનનો ઉપયોગ ધંધાઓ માટે ડિલિવરી અને લોડિંગ અને અનલોડિંગ સગવડમય બનાવવા માટે કરી શકાય છે. સીટી જોલ્ન સ્ટ્રીટ અને ક્વીન સ્ટ્રીટ પર સમર્પિત લોડિંગ/અનલોડિંગ ઝોન પણ વિચારી રહ્યું છે, જે રેસ્ટોરન્ટ્સ અને ફૂડ બિઝનેસીસ માટે પિકઅપ્સમાં સહાયતા કરશે.

વટેમાર્ગુઓ (પેડેસ્ટ્રિયન્સ) માટેનો પ્રવેશ માર્ગ બધાં ધંધાઓ માટે જાળવવામાં આવશે, અને સાઈડવોક્સ ખુલ્લા રહેશે. બુલેવાર્ડ્સમાં ટૂંક સમયનું અમુક કામ રહેશે, જે પછી કર્સ અને સાઈડવોક્સ સંપૂર્ણપણે બદલવામાં આવશે, જ્યારે વટેમાર્ગુઓને સ્ટ્રીટની બીજી બાજુએ અવરજવર કરવા દેવામાં આવશે.

સમયરેખાઓ સહિત, બાંધકામ પર વધુ વિગતો માટે [રીજીયન ઓફ પીલની](#) વેબસાઈટ જુઓ.

સપોર્ટ લોકલ

બ્રેમ્પટનના ડાઉનટાઉનના ધંધાકીય સમુદાય પર COVID-19 મહામારીથી સખત ફટકો પડ્યો છે, અને સીટી ભંગાણુ ઘટાડવા અને ધંધાઓને આર્થિક રિકવરી મેળવવામાં સહાયરૂપ થવા માટે સમર્પિત છે ત્યારે સીટી જાહેર સ્થળોએ તીવ્ર સુધારાઓ કરવા મુખ્ય માળખાગત સગવડોમાં સુધારાઓમાં રોકાણ કરવાનું ચાલુ રાખે છે.

રહેવાસીઓને આ સમય દરમિયાન ડાઉનટાઉનના ધંધાઓની મુલાકાત લેવાનું ચાલુ રાખવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. તમે બ્રેમ્પટનના બધાં નાના ધંધાઓની સંપૂર્ણ યાદી [સપોર્ટ લોકલ બ્રેમ્પટન વેબસાઈટ](#) પર જોઈ શકો છો.

બાંધકામ ચાલુ છે ત્યારે તમારા મનપસંદ ધંધાઓની મુલાકાત લેવા ઉપલબ્ધ પાર્કિંગ વિકલ્પોની સંપૂર્ણ યાદી માટે વેબસાઈટ જુઓ, www.brampton.ca.

ડાઉનટાઉન બ્રેમ્પટન પ્રોજેક્ટ્સ સેન્ટર

[ડાઉનટાઉન બ્રેમ્પટન પ્રોજેક્ટ્સ સેન્ટર \(DBPC\)](#) ખુલ્લું છે. સીટી કર્મચારીઓ ડાઉનટાઉનના ધંધાઓ અને રહેવાસીઓને સહાયતા કરવા, અને ડાઉનટાઉનને પુનર્જીવિત કરવા કાર્યક્રમો અને પહેલો કરવાનું ચાલુ રાખવા તૈયાર છે. બાંધકામ કામગીરી દરમિયાન પણ પીલ રીજીયનના કર્મચારીઓ ઉપલબ્ધ રહેશે.



DBPC વિશે વધુ માહિતી અહીંથી મેળવો, www.brampton.ca/downtownbrampton.

ઈન્ટિગ્રેટેડ ડાઉનટાઉન પ્લાન વિશે

આ સુધારાઓ સીટીનો ઈન્ટિગ્રેટેડ ડાઉનટાઉન પ્લાન (IDP) ચલિત કરવાનો મુખ્ય ભાગ છે, ડાઉનટાઉન બ્રમ્પટનની ઘણી ચાલુ પહેલો અને ભાવિ વિકાસ અને વ્યૂહાત્મક રોકાણને માર્ગદર્શન આપવા અપેક્ષિત માળખાગત સગવડોના પ્રોજેક્ટ્સનું સંકલન કરવાની કાર્યવાહી માટેનો રોડમેપ છે.

IDP નાં માર્ગદર્શક સિદ્ધાંતો છે, સમાવેશપાણું, નવીન શોધ અને કાયમીપાણું. તેનાથી માળખાગત સગવડો સુધારવાના, શહેરી ડિઝાઇન, જમીન ઉપયોગ, અને કામકાજ હસ્તક્ષેપોનું સંકલન કરવામાં - બ્રમ્પટનને આર્થિક ચાલક, પ્રાદેશિક સાંસ્કૃતિક કેન્દ્ર, અને ઈનોવેશન ડિસ્ટ્રિક્ટ તરીકે સ્થાપિત કરવામાં મદદ મળશે.

IDP પર વધુ માહિતી મેળવવા વેબસાઈટ જુઓ, www.brampton.ca/IDP.

ડાઉનટાઉન બ્રમ્પટન પર વધુ માહિતી મેળવવા વેબસાઈટ જુઓ, www.brampton.ca.

-30-

મીડિયા સંપર્ક (MEDIA CONTACT)

સીટી ઓફ બ્રમ્પટન મલ્ટીકલ્ચરલ મીડિયા

multiculturalmedia@brampton.ca